



Mayor's Office of
Immigrant Affairs

ઇમિગ્રન્ટ અફેર્સ માટે
મેયરની કાર્યાલય

ઇમિગ્રન્ટ ન્યૂ યોર્ક વાસીઓ માટે સંસાધનો

તમારી ઇમિગ્રેશન સ્થિતિને ધ્યાનમાં લીધા વિના,
ન્યૂ યોર્ક સિટી અહીં તમારી મદદ માટે છે.



ઇમિગ્રેશન કાનૂની મદદ

મફત અને સલામત ઇમિગ્રેશન કાનૂની સહાય માટે 800-354-0365, સોમવારથી શુક્રવાર, સવારે 9 થી સાંજે 6 સુધી કોલ કરો.



NYC ID કાર્ડ

IDNYC માટે અરજી કરો, 10 અને તેથી વધુ વયના તમામ NYC નિવાસીઓ માટે મફત મ્યુનિસિપલ ઓળખ કાર્ડ. ઓનલાઇન રિન્યૂ કરો અથવા એપોઇન્ટમેન્ટ લો, નોંધણી માટે કોલ 311 કરો અથવા nyc.gov/idnyc ની મુલાકાત લો.



અંગ્રેજી વર્ગો

ગમે ત્યારે, ગમે ત્યાં મફત અંગ્રેજી શીખો. વધુ માહિતી માટે wespeaknyc.cityofnewyork.us ની મુલાકાત લો.

આરોગ્ય સંભાળ



NYC Health + Hospitals (H+H) કટોકટીની સંભાળ, મૂળભૂત આરોગ્ય સંભાળ, તપાસ, રસીકરણ અને ઘણું બધું પ્રદાન કરી શકે છે. તમારા નજીકના કેન્દ્ર માટે દિશા નિર્દેશ પ્રાપ્ત કરવા માટે 718-387-6407 પર કોલ કરો. NYC Care પ્રોગ્રામ સહિત આરોગ્ય વીમા યોજનાઓમાં નોંધણી કરાવવા માટે, 646-NYC-CARE (646-692-2273) પર કોલ કરો અથવા nycare.nyc.gov ની મુલાકાત લો.



માનસિક સ્વાસ્થ્ય

માનસિક સ્વાસ્થ્ય સંભાળ અને પદાર્થના ઉપયોગના સંસાધનોના ગોપનીય સમર્થન અને જોડાણો માટે, 888-692-9355 અથવા 988 પર કોલ કરો, 65173 પર WELL ટેક્સ્ટ મોકલો અથવા મુલાકાત લો mentalhealthforall.nyc.gov

કટોકટીઓ



કટોકટીમાં, 911 પર કોલ કરો. કટોકટી એ એવી કોઈ પરિસ્થિતિ છે જેમાં પોલીસ, ફાયર વિભાગ અથવા એમ્બ્યુલન્સની તાત્કાલિક સહાયની જરૂર હોય છે. કાયદા દ્વારા, ન્યૂ યોર્ક સિટી પોલીસ ડિપાર્ટમેન્ટ ગુનાના પીડિતો, સાક્ષીઓ અથવા અન્ય લોકો કે જેઓ મદદ માટે પૂછે છે તેમની ઇમિગ્રેશન સ્થિતિ વિશે પૂછી શકતું નથી.

જાહેર શિક્ષણ



4-21 વર્ષની વયના તમામ NYC બાળકો જાહેર શાળામાં જઈ શકે છે. નોંધણી કરાવવા માટે, schools.nyc.gov/fwc ની મુલાકાત લો અથવા 311 પર કોલ કરો.



સામાન્ય સિટી સંસાધનો અને માહિતી

શહેરના સંસાધનોનો ઉપયોગ કરવા માંગો છો અથવા કોઈ સમસ્યાની જાણ કરવા માંગો છો? 311 પર કોલ કરો અથવા portal.311.nyc.gov ની મુલાકાત લો.



NYC ઇમિગ્રન્ટ અફેર્સ હોટલાઇન

અમારી હોટલાઇન 212-788-7654 પર સોમવારથી શુક્રવાર, સવારે 9 વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધી કોલ કરો અથવા અમને askmoia@cityhall.nyc.gov પર ઇમેઇલ કરો.



Mayor's Office of
Immigrant Affairs

ઇમિગ્રન્ટ અફેર્સ માટે
મેયરની કાર્યાલય

ઇમિગ્રન્ટ ન્યૂ યોર્ક વાસીઓ માટે સંસાધનો

તમારી ઇમિગ્રેશન સ્થિતિને ધ્યાનમાં લીધા વિના,
તમારી પાસે અધિકારો છે.

ઇમીગ્રેશનમાં થતી છેતરપિંડી ટાળો

જો તમને ઇમિગ્રેશન કાનૂની સલાહની જરૂર હોય, તો માત્ર લાયસન્સ પ્રાપ્ત એટર્ની અથવા માન્યતાપ્રાપ્ત પ્રતિનિધિ પાસે જ જાઓ. તમે nyc.gov/immigrants પર માન્યતાપ્રાપ્ત અને માન્ય પ્રદાતાઓની સૂચિ શોધી શકો છો.

ઇમીગ્રેશન અમલીકરણ સાથેના અધિકારો

NYC ઇમિગ્રેશન અમલીકરણનું સંચાલન કરતું નથી. જો ફેડરલ ઇમિગ્રેશન અમલીકરણ દ્વારા તમારો સંપર્ક કરવામાં આવે, તો તમારી પાસે અધિકારો છે. nyc.gov/knowyourrights ની મુલાકાત લો અથવા **800-354-0365** પર અમારી મફત ઇમિગ્રેશન કાનૂની હોટલાઇન પર કોલ કરો.

કામદારોના અધિકારો

તમને ન્યૂ યોર્ક સિટી કાયદા હેઠળ માંદગી રજા, લઘુત્તમ વેતન, ઓવરટાઇમ પગાર અને વધુ ચૂકવવાનો અધિકાર છે. સંસાધનો માટે nyc.gov/workers ની મુલાકાત લો અથવા **212-436-0381** પર કોલ કરો.

ભેદભાવની જાણ કરો

પજવણી અને ભેદભાવ NYC માનવ અધિકાર કાયદા હેઠળ ગેરકાયદેસર છે. ભેદભાવની ઘટનાની જાણ કરવા માટે, કૃપા કરીને **212-416-0197** પર કોલ કરો.

ઘરેલું હિંસા સામે સંરક્ષણ

જો તમે તમારી સાથે ગેરવર્તન થવાનો અનુભવ કરી રહ્યાં હોવ તો NYC તમને મદદ કરવા માટે અહીં છે. તમે nyc.gov/nychope ની મુલાકાત લઈ શકો છો અથવા **800-621-HOPE** પર NYC ની ઘરેલું હિંસા હોટલાઇન પર કોલ કરી શકો છો.

ભાડૂતના અધિકારો

ખાલી કરાવવા અથવા તમારા મકાનમાલિકને લગતી કોઈ સમસ્યામાં મદદની જરૂર છે? nyc.gov/tenantprotection ની મુલાકાત લો અથવા **311** પર કોલ કરો અને મફત કાનૂની સહાય માટે "tenant helpline" (ટેનન્ટ હેલ્પલાઇન) કહો.

આશ્રયનો અધિકાર

જો તમે બેઘરતાનો અનુભવ કરી રહ્યાં હોવ તો તમને આશ્રયની વિનંતી કરવાનો અધિકાર છે. નિયુક્ત DHS ઇન્ટેક કેન્દ્રની મુલાકાત લઈને આશ્રય સેવાઓનો ઉપયોગ કરો. **311** પર કોલ કરીને વધુ જાણો.

ગ્રાહક સુરક્ષા

વ્યવસાયમાં સમસ્યા છે? ગ્રાહક તરીકે, તમારી પાસે અધિકારો છે. nyc.gov/consumers ની મુલાકાત લઈને ફરિયાદ નોંધાવો અથવા **311** પર કોલ કરો.